

P.09

સોનાદી તેના પતિ  
પ્રથેનો પ્રેમ વ્યક્તિ  
કરવામાં કચારેય  
ડર્ટી નથી

[www.lokpatrika.in](http://www.lokpatrika.in)

તંત્રી : અવેશ માલવિયા | સ્થાપના : ૨૦૧૦ | વર્ષ : ૦૩ અંક : ૧૦૬ | વિકભ સંવત ૨૦૧૧ : કારતક ૧૬ ૦૭ | પાના - ૧૦ | કિંમત : ૪ | અમદાવાદ (ગુજરાત)

Editor : Avesh K Malaviya • Year : 03 • Issue : 106 • Dt. 22-11-2024 Friday • Page 10 • Price : Rs. 4 • Office : G-1301, Sardar Patel Nagar, Shastrinagar Char Rasta, Near Anmol Tower, Naranpura, Ahmedabad-380013 • E-mail : lokpatrikanews1@gmail.com • Mob. 98252 52125

છૂટાહેડાંનો કેસ ચાલુ હોય  
ત્યારે પણી પતિના ઘર  
જીવી જ સુવિધા મેળવવા  
કંડાર : સુપ્રીમ



09

LOK PATRIKA

RNI No : GUJGUJ/2022/83673

22  
NOVEMBER- 2024  
FRIDAY

09



ઈંગ્રાયેલના હુમલા પણી પણ  
અમેરિકાનું કંઈ દુશ્મન ઈરાન  
અડીખમ | પરમાણુ હથિયાર  
ભનાવવાની નજીક

P.09

હે પંજાની  
સિંગર દિલજીલ  
મુંલીમાં દિલ  
જુતા જેવા મળશે



DevAashish®  
Where Dreams Come Home

॥ દ્યાજુ જ્ય સ્વામિનારાયણ ॥

જોશો એટલે દિલ કહેશે  
**‘ઘર હોય તો દેવ આશિષનું!’**

AT NARODA

Dev Aashish  
pride & plaza

3 BHK - 63.88L\*

- Possession Shortly
- Sample House Ready
- Allotted Car Parking
- 100% Dastavej

**7874 00 40 00**

GUJRERA.GUJARAT.GOV.IN RERA NO: PR/GJ/AHMEDABAD /AHMEDABAD CITY/AUDA/MAA06419/041219

B/h Capital Commercial Complex, Nr. Sahitya Hill and Icon, Naroda, Ahmedabad

FEW UNITS LEFT

2 BHK - 34.96L\*

- Sample House Ready
- Ready Possession
- Allotted Car Parking
- 100% Dastavej

**78 78 78 6494**

GUJRERA.GUJARAT.GOV.IN RERA NO: PR/GJ/AHMEDABAD /DASKROI/AUDA/MAA07349/190820

Dev Aashish  
Sky

Dev Aashish  
pride+

2 BHK - 50.80L\* | 3 BHK - 69.60L\*

- Sample House Ready
- 100% Dastavej

**7874 00 40 00**

GUJRERA.GUJARAT.GOV.IN RERA NO: PR/GJ/AHMEDABAD /AHMEDABAD CITY/AUDA/MAA10947/181122

Nr. Dev Aashish  
Pride & Plaza, 200 Ft. Road,  
Naroda-Dehgam Road,  
Ahmedabad.



FEW UNITS LEFT

2 BHK - 46.40L\* | 3 BHK - 62.56L\*

- 100% Dastavej

Dev Aashish Z+

Opp. Hanspura Residency,  
Nr. D-Mart, Naroda-Dehgam  
Road, Ahmedabad

**9512 381 381**

GUJRERA.GUJARAT.GOV.IN RERA NO: PR/GJ/AHMEDABAD/DASKROI /AUDA/RAA08919/210821





**સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌબાંડ**

# ગુજરાત રાજ્યમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા આશરે પચાસ ટકા વધુ દર્દી બોગસ!!!

ડેક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના કુલ બિલની રકમના 20થી 40 ટકા સુધીના કમિશનની ડોક્ટરને ઓફર કરે છે



એકાઉન્ટિંગ અમદાવાદ, તા. ૨૧।  
મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ  
દર્દીઓને ખેંચી લાવીને લુંટ ચલાવવા  
માટે ગ્રામપણેયતના વડાને સારી  
એવી રકમની લાંબા આપીને ફોરી  
નાખે છે. ત્યારાબાદ ગામામાં જી  
મેડિકલકેપનું આયોજન કરે છે.  
ખાસ કરીને હૃદયરોગની બીમારી,  
સંતાળાની દુર્પતિઓને આકર્ષવા  
ઈન્ડિસ્પીલિના અને એન્ડોપીડિક  
સમયની લગતા મેદપનું આયોજન  
કરે છે, મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટ  
ટલ સાથે સંકાયાદેલા સૂધોનું કહેતું  
છે. કેન્પાના ખર્ચ કરતાં દસ ગણી  
આવક કરવાની ગણતરી સાથે  
દર્દીઓને ડરાવીને હોસ્પિટલસ  
સુધી ખેંચી લેવા ખર્ચના વાદામાં  
ઉતારે છે. ઘરે અચાનક કશુંક થઈ  
જતાં દર્દીને હોસ્પિટલમાં હોસ્પિટ  
ટલમાં લાવવામાં આવે તો તેમને  
આઈસીયુની જ દાખલ કરી દેવામાં  
આવે છે. એઈસીયુની બિલ નોર્મલ  
ખાલ કરતાં નાખી ચાર ગણા વધારે  
હોય છે. એઈસીયુની લીધા પછી  
છી. સ્વાજન એકાઉન્ટિંગ બીમાર ૫

સીધું હોસ્પિટલ ચલાવે છે. બસે  
પ્રોફેશનલ અભિગમની ફક્ત નંબો  
કરવાના ધ્યેયી આગળવથતા  
હોવાથી તેમનામાં અનુકૂળ કે  
સહાનુભૂતિની છાંટેયે હોતો નથી,  
દર્દી પહેલા તેઓ ડોક્ટરને આપ્યે  
છે. તેમના માટે હોસ્પિટલના  
ઈન્ડિસ્પીલિન હાઇલાઇટ કરીને  
ડોક્ટરને આકર્ષયાંતું કરા કરે  
છે. ડેક્ટર ખેંચાઈ ન આવે તો  
તેમને દર્દીના કુલ બિલની રકમના  
20થી 40 ટકા સુધીના કમિશનની  
ડોક્ટરને ઓફર કરે છે. રેગ્યલર  
ઓબ પર લેવામાં આવેલા ડોક્ટરને  
વાર્ષિક એક કોર્ટનો પારાર ઓર્ડર  
કરવામાં આવે છે, ત્યારે જ તેમને વર્ષે  
નાખી રોડ કરીની ઈન્કમ જનરેટ  
કરવાનું રાંગે આપી દેવામાં આવે  
છે. આ રાંગે પૂર્ણ કરવા દર્દીએને  
ટ્રેપમાં લે છે. મલ્ટીસ્પેશિયાલિટી  
હોસ્પિટલ દર્દીઓને ખેંચી લાવીને  
લુંટ ચલાવવા માટે ગ્રામપણેયતના  
વડાને સારી એવી રકમની લાંબા  
ધોયાને સારી એવી રકમની લાંબા  
ધોયાને એવી રકમની લાંબા પછી

**એસાઓજુની ટીમે નારાણપુરામાંથી સાત પેડલરો ઝડપાયા  
ડ્રગની પાર્ટી કરવા માટે મકાન ભાડે  
પણ મળે છે। ૨૫.૬૮ લાખનું ડ્રગ્સ જમ્**

પ્રતિનિધિ, અમદાવાદ, તા. ૨૧।

એસાઓજુની ટીમે નારાણપુરા ફેન ટેન્સારા  
પાસેના એલિફન્ટા એપાટ્મેન્ટ્સનો દરોડો કરીને  
પાર્ટી માટે મકાન ભાડે આપનાર કિન્નરેશ પ  
જ્યા સહિતના સાથે ઝ્રેસ સાલાયર-પેડલરોને  
જડપી લીધી છે. તેમની પાસેની ૨૫.૬૮ લાખનું  
ઝ્રેસ જમ કરાયું છે. અમદાવાદ એસાઓજુની  
ટીમે નારાણપુરાની ટીમને બાતમી  
મળી હતી કે, ફિલેવાડીનો મુસ્તકીમ શેખ રહ્ન  
ઝ્રેસની ધૂંધો કરી રહ્યો છે. તેણે દર્ઘાપદેશમાં  
રહેતા મોહેમદ બાન પાસેથી ઝુસનો જાઓ  
મગાયો છે. મોહેમદ બાન, મુસ્તકીમ સહિતના  
શહેરના ઝુખ્યાત ઝ્રેસ પેડલરોને નારાણપુરાના

શહેરના ઝુખ્યાત ઝ્રેસ પેડ





## CYBER SECURITY AND ETHICAL HACKING TRAINING IN AHMEDABAD

**BECOME A CYBER SECURITY SPECIALIST  
WITH FALGUN RATHOD**

# Learn Ethical Hacking & Cyber Security

## WHY JOIN CYBER OCTET ?

- ✓ LEARN MORE THAN 120 TOPICS UNDER ONE ROOF AT #CYBEROCTET
- ✓ TASK AND RESEARCH BASED TRAINING
- ✓ 100 % PLACEMENT ASSISTANCE
- ✓ LIVE PROJECTS
- ✓ INTERNATIONAL ACCREDITATION

### TRAINING BY:-

THE MOST EXPERIENCED TRAINER "MR.FALGUN RATHOD"  
LISTED IN INDIA'S TOP 10 ETHICAL HACKERS AND CYBER  
SECURITY EXPERT

## ADVANCED DIPLOMA IN ETHICAL HACKING AND CYBER SECURITY (1 YEAR)

### WHO CAN JOIN

STUDENTS

WORKING PROFESSIONALS

BUSINESS OWNERS

Contact Now

C-709,Titanium City Center, Prahladnagar road, Ahmedabad

91 7405321234



info@cyberoctet.com



www.cyberoctet.com

# શરીરને ફિટ રાખવા માટે સાઇકલિંગ બેસ્ટ એક્ઝિટિવિટી



આ જના સમયમાં લાઈફસ્ટાઇલને કાર્યો

આ સમયથી બધા માટે અને શરીરને સસ્થ રાપવા માટે શારીરિક એક્ઝિટિવિટી પણ જરૂરી છે. આ શારીરિક એક્ઝિટિવિટીમાં સાઇકલિંગ એક બેસ્ટ એક્ઝિટિવિટી છે.

સાઇકલિંગથી ફિટ રહેવાની સાથે-સાથે વજન પણ ગુપ્તપણી ઘટાડે. સાયુચુને ટેન કરવા, હાડકાને મજબૂત કરવા અને વજન ઘટાડવા માટે આ સાઇકલિંગ બેસ્ટ કસરત છે. પરંતુ માત્ર વાંબા સમય સુધી સાઇકલ ચલાવવાથી કામ નહીં ચાલ પરંતુ વજન ઉત્તરાવાના હાંસલ કરવા માટે પણ ધ્યાન નિયમનું પાલન કરવું પડશે. પેટની ચર્ચા ઘટાડવા માટે લાંબા સમય સુધી સાઇકલિંગ કરવું જરૂરી છે. ઓછા ગીય સર્સા પર સવારી કરવા જાઓ, જેથી તમે વાંબા સમય સુધી સાઇકલ ચલાવી શકો અને બોડી કેટને સરળતાથી દૂર કરી શકો.

સવારાના નાસ્તા પહેલા સાઇકલિંગ કરવાના અનેક ગણ્યો ફાયદો થાય છે. એક વારસમાં દાંબો કરવાનાં આંદો છે કે, ખાલી પેટે સાઇકલ ચલાવવાથી 20 ટકા વજુ જરૂરી ચર્ચા બર્ન થાય છે. સાઇકલ ચલાવવાથી મન હંમેશા ફેશ રહેશે.

તો એક રિપોર્ટ અનુસાર, સાઇકલ ચલાવવાથી કેન્સરનું જોખમ ઘણી શકે છે. એક રિસર્ચ અનુસાર, જે લોકી દરરોજ 2 કલાક સાઇકલ ચલાવતા હતા, તથો પેટના કેન્સરનું જોખમ વાગનું 50 ટકા આંદૂ જોખમ મળ્યું હતું. રિસર્ચ અનુસાર, જે મહિલાઓ વોડિંગ અથવા સાઇકલ ચલાવતી હતી તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ 10 ટકા આંદૂ જોખમ મળ્યું હતું. આ આખારે એંનું નાની શક્ય છે કે સાઇકલ ચલાવવાથી કેન્સરના જોખમને અમૃત હદ સુધી ઘટાડવામાં મદદ મળી શકે છે.

# સહેલાણીએ કુદરતી સૌંદર્ય માણવા માટે હાથણી માતાનો ધોંધ ફેવરિટ હિલ સેટેશન

**છુટી** થથી માતા ધોંધ એ યુજાતનો જાણીતો ધોંધ સરસવા ગમ આગળ આવેલો છે. હાંલોલથી પાવાઘણ અને શીરચાઝ્ઝર થઈને પણ આ ધોંધ તરફ જવાય છે. ગોપથાણી આ ધોંધનું અંતર 56 કિમી. અને વેગરાથી 80 કિમી દૂર છે.

થથી માતાનો ધોંધ ખૂબ ઊંચી ખદ્દાન ટેક્સીઓ વચ્ચે આવેલો છે અનેની એક ટેક્સી પરસી આવતી નદીની પાણી, ટેક્સીની ઊંચી કરાડ પર થઈને ધોંધ પણ છે. સામે ઉભા રહેણે, ટેક્સીના વાંકાચુકા ખડકો પરસી ઉછળનો ફૂટો અને નાંદો પડો ધોંધ જોખી મજા આવે છે. ધોંધ નીચે જે જ્ઞાને પેંચે તાણ પણ વાંકાચુકા ખડકો અને સુંદર અરજણની પરચાયેલા છે. તથા આજુખાજુ વશી અને ગીય આપી છે. એટલે ત્યાં સુધી પણોચ્ચાવાનું પણ અધરું છે. આમ છતાં, ધીરે ધીરે સાચવીને ત્યાં જરૂર પણોચ્ચા રાખ્ય છે. જ્યાં ધોંધ પેંચે તે જાળાએ એક ગુઢા છે. તેમાં હાથથીના આકારનો મોટો ખડક છે.

પ્રકૃતિને માણવા આવતા પ્રકૃતિપ્રેમીની સાથે સાથે ટેલવાક સાંખસિક વૃત્તિને સંતોષવા માટે પણ હાથથી માતાના ધોંધ અને અસપાસના વિસ્તારની મુલાકાત લેતા હોય છે. હાથથી માતાનો ધોંધ જે હુંગર ઉપર થી વહે છે, તે આપું વિરતમાળા સમાન ખૂબ જ ઊંચાઈ ધરાવતી ટેક્સી છે. ત્યારે વિચારીએથી પણ નન્યાનરામ દરશોને જોવા માટે ધૂવાનો જોખમ બેનીને પણોચ્ચાવતી હોય છે અને હુંગર પર વધી એક કિનારા સુધી આવી સેલ્ફી લેતા હોય છે. અને ખૂબ જ મોટો સંખ્યામાં ધૂવાનોમાં આ મોતાની સેલ્ફીનો ડેઝ જોવા માટે.



## સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળી છે અનેક રોગની દવા



## રાત્રે ચહેરા પર આ વરસ્તુઓ લગાડવાથી તવા પર આવશે જબરદસ્ત ગલો...



**છુટી** રાત્રિયાણીનું આધ્યાત્મિક ભરપૂર હોય છે. અને શરીરના આધ્યાત્મિક ધોંધ અને પોટેટોયમની ખામી હોય, મહિલાઓને માસિકના અન્યાન્ય ધોંધ અને પોટેટોયમની ખામી નીવે છે. વરિયાળીમાં કેટિયાન, સુરિયાન, આયરન, પોટેટોયમ જેવા લાભકારી તવ હોય છે. જે મહિલાઓને અનિયતિમાં માસિકની સમસ્યા હોય તેમણે સાવારે ખાલી પેટ હુંકાણા પાણી સાથે 1 ચમ્ચી વરિયાળી ખાવી જોઈએ. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય જોયશે.

આંગ માટે કાયદાકારક: વરિયાળીનું સેવન કરવાની આધ્યાત્મિક ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત રોજ ભોજન કર્યા પણ ધૂમરૂં કરી જીવાની અને પોટેટોયમની ખામી જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.


ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ ઉપરાત વરિયાળીનું કર્યા પણ ધૂમરૂં કર્યા જોઈએ. ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ.

ધૂમરૂં કર્યા પણ ધોંધ અને પોટેટોયમની ખામી જોઈએ. આ

# ਟੱਟ ਕਰਤੀ ਵਖਤੇ ਗਰੋਧਨਮਾਂ ਗੰਭੀਰ ਈਜ਼

# ‘ગુડચારી ર’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો



અભિનેતા ઈમરાન હાશ્મીનો એક ફિલ્મના સેટ પર અક્ષમત થયો હતો, જેમાં તે ધાયલ થયો છે. તેની ગરદન પર ઈજા થઈ છે. ઈમરાન હાશ્મીની ધાયલ તસવીરો પણ ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ થતાં ફેસની ચિંતા વધી ગઈ છે. ઈમરાન હાશ્મીની તાજેતરમાં જ ગુડાયારી ર'ની કાસ્ટ સાથે જોડાયો છે. ડેઢરાબાદમાં એક ઈન્ટરન્સ એક્શન સીન શૂટ કરતી વખતે ગરદનમાં ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે જમ્ય સિકવન્સ દરમિયાન અભિનેતા ધાયલ થયો હતો, જેના કારણે તેની ગરદન પર ઊડો કટ પડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેતી તસવીરમાં અભિનેતાની ઈજા સાથે લોહી દેખાઈ રહ્યું છે, જેના કારણે તેના ચાહકોની ચિંતા વધી ગઈ છે. ઈમરાન હાશ્મી ડેઢરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર, ઈમરાન હાશ્મીને આ ઈજા તે સમયે થઈ હતી જાયો તે એક મુશ્કેલી સ્ટાન્ડનું શૂટિંગ કરી રહ્યો હતો. પ્રોડક્શન સેટના એક સૂરતોએ કહ્યું, ‘ઈમરાન એક એક્શન સીન શૂટ કરી રહ્યો હતો ત્યારે તેની ગરદનમાં ઈજા થઈ હતી. આ ઈજા કદાચ જમ્પિંગ સીન દરમિયાન થઈ હતી. ઈમરાન હાશ્મી ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ કરી શરૂ કરી શકે છે. ઓગસ્ટમાં અભિનેતા આદિવી શેષેને ઈમરાન હાશ્મીની ગુડાયારી ર'માં જોડવાની જાહેરત કરવામાં આવી હતી, જેણે તરત જ ચાહકોને સહયોગ માટે ઉત્સાહિત કર્યા હતા.

## ગુલશન કુમાર પરની બાયોપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય

**ભુષણ કુમાર હાલ તો 'ભુલભુલૈયા ૩'ની સફળતાનો આનંદ માણે છે**

ભૂષણ કુમાર હાલ તો ‘ભૂષણભૂલેયા ઉ’ની સફળતાનો આનંદ માણે છે. તાજેતરમાં તેમણે તેમની આવનારી ફિલ્મ પિતા ગુલશનકુમારની બાયોપિક વિશે પણ વાત કરી હતી. જોકે, આ ફિલ્મ વિશે ઓફિશિયલ કોઈ જાહેરત થઈ નથી. પરંતુ આ ફિલ્મ અંગે ઘણી ચર્ચા હતી, કરણ કે તેમાં આમિર ખાન લીડ રોલમાં હતો. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ભૂષણ કુમારે કહ્યું હતું કે તેમની પાસે આ ફિલ્મની સ્કિપ્ટ પણ હતી, પરંતુ તેમના માતા સહમત ન હોવાથી કામ આગળ વધ્યું નહીં. “અમે હજુ એ લાખી રહ્યા છીએ. અમારી સ્કિપ્ટ પહેલાં તેયાર જ હતી. અમે ભલે કોઈ ઓફિશિયલ જાહેરત ન કરી હોય તેમ ઇન્ટાન્ બધાં જાણતાં હતાં કે, આમિર ખાન તેનો ભાગ હતો. એ હજુ પણ આ કામ કરવા માગે છે, તે મને હેમેશા કઢે છે કે તેણે વાંચેલી આ શ્રેષ્ઠ સ્કિપ્ટ છે. પરંતુ અમારા પરિવાર તરફથી તેમાં થોડો ખચકાટ હતો, ખાસ કરીને મારા માતા, એ કોઈ અલગ દૃષ્ટિકોણથી આ વાર્તા કહેવા માગતી હતી અને અમે કોઈ બીજા દૃષ્ટિકોણથી લખી હતી.” આગળ ભૂષણકુમારે કહ્યું, “મારી માતા જે સ્કિપ્ટ સાથે સહમત ન હોય તો હું મારા પિતા વિશે ફિલ્મ બિલકુલ બનાવી ન શકું. એક વખત એ સહમત થશે, જે સમયાંતરે થવાના જ છે, ત્યારે દુનિયાને એક પ્રેરણાદારી સ્ટોરી જોવા મળશે. અમે પ હેલાની સ્કિપ્ટ રદ નથી કરી, માત્ર એમાં થોડાં ફેરફાર કરી રહ્યા છીએ. મારા માતા પણ ઈચ્છે છે કે લોકો તેમના વિશે નથી જાણતા એવી વાતો લોકોને જાણવા મણે.” ૧૯૮૮ ઉમાં ભૂષણકુમારના પિતા ગુલશન કુમારે ટી-બિઝિન્ઝી સ્થાપના કની હતી.



# એક દિવસમાં ૨૦૦ જૈટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્યન


## ਕੋਲੇਜਮਾਂ ਬਹੁ ਅਧਿਕਾਰੀ ਹਿਰਾ



अभिताभ बच्यन पोतानी स्ट्रॉक्ट लाईफस्टार्टल माटे जाणीतो  
छ. ते हवे स्मोक करतो नथी अने दाढ़ पष्ठा पीतो नथी परंतु शुं तमने  
भबर छे के एक समय ऐवो हतो ज्यारे अभिताभ एक दिवसमां  
२०० सिगारेट पी जतो हतो. एक ज्ञाना इन्टरव्यूमां अभिताभे आ  
विशे वात करी हनी. अभिताभे ज्ञानाव्यु के 'हु नोनवेज खातो नथी प  
रंतु मारी पत्ती ज्या खाय छे.' अभिताभे कहुं, 'हु स्मोक करतो नथी  
अने ड्रिंक पष्ठा करतो नथी अने नोनवेज पष्ठा खातो नथी. आ कोई  
धर्मना कारणे नहीं परंतु टेस्टना कारणे छ. मारा परिवारमां मारा पि  
ता वेजिटेरियन हता अने मारी माता नहीं. तेवी ज रीते ज्या नोनवेज  
खाय छे अने हु नहीं. हु पहेला भीट खातो हतो. ड्रिंक अने स्मोक पष्ठा  
करतो हतो परंतु हवे बधुं छोटी दीधुं छे. कोलकातामां हु एक दिवसमां  
२०० सिगारेट पीतो हतो, हां २००. परंतु मुंबई आव्या बाई भेचे  
छोटी दीधी. हु ड्रिंक पष्ठा करतो हतो, कंठ पष्ठा होय जे हाथमां आवे  
ते पीतो हतो परतु अमुक वप्पी पहेला मे नकडी किर्यु के मने आनी जडूर  
नथी. आ टेवोना कारणे मने कोई तकलीफ थती नहोनी. मात्र ज्यारे हु  
विदेशमां शूटिंग करी रवो होव यारे केम के त्या वेजिटेरियन भोजनने  
लाईने मुश्केली पढे छे.' अभिताभे कहुं के हु अहिंसक माणसस छ. मने  
नथी लाग्तु के हु हिंसक माणसस छ. हु मारुं नियंत्रणा पष्ठा गुमावतो  
नथी. हा, कोलेजना दिवसोमां अमुक जघडा थता हता परंतु आटहुं  
ज. स्कीन पर लडत खूब अनरियल होय छे.

# ਫੈਨਿਕਾਈਜ਼ ਨੇ ਕੇਂਦਰ ਸੋਨੁ ਕੇ ਟੀਕੂ ਕੀ ਖੀਟੀਨੇ ਪਣ ਬੀਜੇ ਭਾਗ ਆਵਸ਼ੇ

બોલીવુડમાં ‘ભૂલભૂલૈયા શ્રી’ અને ‘સિંગધમ અગેઈન’ હિત જતાં તમામ સર્જકોને અને કલાકારોને પોતાની જૂની કિલ્ભોની ફેન્ચાઈજિને આગળ વધારવાની તલખ જાગી છે. કાર્તિક આર્થને પણ ‘ભૂલભૂલૈયા શ્રી’ની સફણતા બાદ તેની હિટ કિલ્મ ‘સાંગુ કે ટીપુ કી સ્વીટી’નો બીજો ભાગ બનાવવા પ્રયાસ શરૂ કર્યા છે. કાર્તિક જોકે આ કિલ્ભોની જૂની ટીમ સાથે જ કામ કરશે કે કેમ તે હજુ નકરી નથી. કાર્તિકની આ કિલ્મ ૨૦૧૮માં રીલિઝ થઈ હતી. તે તેની કાર્ટર્કિની શરૂઆતની હિત કિલ્ભોમાંની એક મનાય છે. તેમાં નુસરત ભરુચા તેની સહકારકાર હતી. કાર્તિક વધુ એક ફેન્ચાઈજી ‘પતિ પતી ઔર વોહ ટૂ’ માટે પણ કામ કરી રહ્યો છે. આ કિલ્મનું શૂટિંગ મોંડું શરૂ થવાનું હતું. જોકે, અનુરાગ બસુની ‘મેટ્રો ઇન હિનો’ રી શૂટના કારણે લંબાઈ જતાં કાર્તિકની અનુરાગ બસુ સાથેની કિલ્મનું શૂટિંગ પણ ઠેલાવું છે. તેનો લાભ લઈને કાર્તિક ‘પતિ પતી ઔર વોહ ટૂ’ માટે શિયુલ ફણવી દીટું છે. રાકિદીની શરૂઆતની હિત કિલ્ભોમાંની એક મનાય છે. તેમાં નુસરત ભરુચા તેની સહકારકાર હતી. કાર્તિક વધુ એક ફેન્ચાઈજી ‘પતિ પતી ઔર વોહ ટૂ’ માટે પણ કામ કરી રહ્યો છે. આ કિલ્મનું શૂટિંગ મોંડું શરૂ થવાનું હતું. જોકે, અનુરાગ બસુની ‘મેટ્રો ઇન હિનો’ રી શૂટના કારણે લંબાઈ જતાં કાર્તિકની અનુરાગ બસુ સાથેની કિલ્મનું શૂટિંગ પણ ઠેલાવું છે.



# ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળા: ભૂમિ પેડનેકર

એકિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેનડથી અલગ રહેતા હોય છે. ભૂમિએ તાજેતરમાં એક ફેશન શો દરમિયાન જણાવ્યું હતું કે, ફેશન અને બ્યુટી ઉપરાંત અનેક બાબતોમાં બેન્ચર્માર્ક સેટ કરવામાં ફિલ્મો મહત્વાનો ભાગ ભજવે છે. સિનેમા સંખ્યાબંધ લોકોને પ્રભાવિત કરે છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ઘણાં સકારાત્મક પરિણામ મળી શકે છે. જો કે વર્ષોથી ફિલ્મોમાં સુંદરતાના સાવ પોકળ અને અવાસ્તવિક માપદંડ રખાયા હોવાનું મારું માનવું છે. ભૂમિએ ફેશનને સેફ એક્સપ્રેશનનું માધ્યમ ગણાવી હતી. ફેશનના કારણે એમ્પાવરમેન્ટ થવું જોઈએ અને વ્યક્તિને મજા આવવી જોઈએ. ભૂમિ પેડનેકરે ૨૦૧૫ના વર્ષમાં ‘દમ લગા કે હઠિશા’થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષોની આ સફરમાં ફેશન અને બ્યુટી બાબતે પોતાનો ટેસ્ટ બદલાયો હોવાનું ભૂમિએ સ્વીકાર્યું હતું. ભૂમિએ કર્વાં હતું કે, સારો ટેસ્ટ ધરાવતા લોકોને મળવા માત્રથી પણ ઘણાં પરિવર્તન આવતાં હોય છે. ફેશનને સ્વીકારવામાં કાયારેક શરમ નહીં જતી હોય છે, પરંતુ આવી શરમ છોડી ફેશનને એન્ઝોય કરવી જોઈએ. ભૂમિ પેડનેકર સસ્ટેનેબલ ફેશન ઉપરાંત પર્યાવરણપ્રેમને પ્રમોટ કરતી હોય છે. ફેશન ઈન્ડસ્ટ્રીના કારણે સૌથી વધુ પ્રદૂષણ ફેલાતું હોવાથી આ ક્ષેત્રમાં સસ્ટેનેબલ ફેશની જરૂર હોવાનું ભૂમિ માને છે. ભારતમાં સિલ્કી માંડીને કોટન સુધી ઘણાં વિકલ્પની પસંદ થવી જોઈએ. એકિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેનડથી અલગ



# ફ્યાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શુટિંગ

તાજેતરના અહેવાલો અનુસાર, ફ્વાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સાટેભરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે



પછી ફવાદ પાકિસ્તાન પાછો ફરશે,  
જ્યારે કિલ્મની ટીમ મુંબઈમાં  
આગળનું શૂટ કરશે. મોટા ભાગના  
દૃશ્યો અને ગીતો લંડનમાં જ શૂટ  
કરવામાં આવશે.” “ઉડતા પંજાબ”,  
‘સુપર ત૦’ અને ‘વિકમ વેધા’  
જેવી કિલ્મોના પ્રોડિયુસર વિવેક  
અગ્રવાલ આ કિલ્મ પ્રોડિયુસ કરી  
રહ્યા છે તેમજ આરતી બગડી આ  
કિલ્મ ટિરેક્ટ કરે છે. ૨૦૨૫  
સુધીમાં આ કિલ્મનું શૂટ પૂરું થઈ  
જશે. તેમજ ૨૦૨૬ની શરૂઆતમાં  
કિલ્મ રિલીઝ થશે. ફવાદ ખાન  
અને મહિલા ખાનની ‘લિફ્ટેન્ડ્ઝ  
ઓફ મૌલા જડુ’ પંજાબમાં ર  
ઓકટોબરે રિલીઝ થવાની હતી.  
પરંતુ તેનો વિરોધ થતાં રિલીઝ  
અટકાવી દેવામાં આવી છે.

# પ્રાઈવેટ વિડિયો લીક થયા બાદ એક્ટ્રેસ ટ્રોલ થઈ



ਕਰੀਨਾ ਕਪੂਰ ਪਈ ਹਵੇ ਹੁਮਾ ਕੁਰੇਸ਼ੀ  
ਡਿਟੈਕਿਟ ਰੋਲਮਾਂ ਜੋਵਾ ਮਣਸ਼ੇ

હુમા કુરેશી પહેલી વખત પોલિસ ઓફિસરના રોલમાં

હુમા કુરેશી તેની આગામી ફિલ્મ 'ભયાન'માં એક પોલિસ ટ્રામા ફિલ્મમાં એક ડિટેક્ટિવના રોલમાં જોવા મળશે અને તેના માટે તે ઘણી ઉત્સાહિત પણ છે. તેની આ ફિલ્મ બુસાના એશિયન પ્રોજેક્ટ માર્કેટમાં પણ મોકલવામાં આવશે. બિકાસ રંજન મિશ્રાએ ડિટેક્ટ કરેલી 'ભયાન' એક એવી મહિલા ડિટેક્ટિવ પર આધારિત ફિલ્મ છે, જે એક લીડ ઇન્વેસ્ટિગેટર તરીકે રાજસ્થાના નાના ગામમાં પોતાના પહેલા કેસની તપાસ કરવા માટે જાય છે. જ્યાં તેના વિરોધીનો સ્થાનિક ક્ષેત્રે સમાજિક રીતે અને વહીવટીતંત્રમાં બહુ પ્રભાવ હોવાથી તેને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. સાથે તેને પોતાના સસરાની છબિને પણ જાળવી રાખવાના હોય છે. બિકાસ રંજન મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ગ્રામ્ય વિસ્તારોના મૂળમાં રહેલી પિતૃ સત્તાક સમાજ વ્યવરસ્થા અને તેના કારણે મહિલાઓ માટે રચાતા એક દાઢા અને સંકુચિત માહોલ પર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું કે તેમનો આ ફિલ્મ બનાવવા પાછળનો હેતુ કોઈ સલાહ-સૂચન કરવાનો નથી પણ આ પ્રકારના માહોલની લોકોના જીવન પર થતી અસર અને તેને દ્વારા લોકોને એ અનુભવ કરાવવાનો છે કે આ માહોલથી ખરેખર કર્દી હં સુધીના પરિણામો આવી શકે છે. હુમા કુરેશી પહેલી વખત એક પોલિસ ઓક્સિસના રોલમાં જોવા મળશે. તેથી તે આ ફિલ્મ માટે ઘણી ઉત્સાહિત છે. તેણે જણાવ્યું, "હું એવી ફિલ્મ પ સંદ કરું હું જેની વાર્તા સાથે હું મારી જીતને જોડી શકું. હું હેમશા અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવાનો પ્રયત્ન કરું હું. જો તેમાં મને એક કલાકાર તરીકે કોઈ નવો પ્રયોગ કરવા મળતો હોય તો મને એનો ભાગ બનાવું ગમે છે. મને જ્યારે 'ભયાન' ઓફર થઈ ત્યારે હું એની વાર્તા, પાત્ર, ફિલ્મન્યાં હેતુ અને આ વાર્તા સેવે જાણાય દુલારા મંદેશ અને બાંસાં."







A Project By  
**GIRIVAR  
BUILDCON**

અદ્રા અમેનીટીજ સાથે,  
→ પ્રાઇમ લિંકિંગ

@ NEW SHAHIBAUG

  
**Sreevas**  
3 BHK & SHOPS



+91 95370 00497 | 77779 20026

Near S.B. Farm, New Shahibaug, Nana Chiloda - 382330

RERA NO. PR/GJ/AHMEDABAD/AHMEDABAD CITY.AUDA/MAA11835/230523 | GUJRERART.GUJARAT.GOV.IN



FOR LOCATION